

Sun Pharmaceutical Industries Limited

Sun House, Plot No. 201 B/1,
Western Express Highway, Goregaon (E),
Mumbai – 400 063, Maharashtra, INDIA.

Tel.: (91-22) 4324 4324

Fax: (91-22) 4324 4343

Website: www.sunpharma.com

Email: secretarial@sunpharma.com

CIN: L24230GJ1993PLC019050

19 July 2025



National Stock Exchange of India Limited

Scrip Symbol: SUNPHARMA

BSE Limited

Scrip Code: 524715

Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 – Newspaper Advertisements

This is to inform that SEBI vide its circular no. [SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2 July 2025](#) has decided to open a special window only for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of 1 April 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise, for a period of six months from 7 July 2025 till 6 January 2026, in order to facilitate ease of investing for investors and to secure the rights of investors in the securities which were purchased by them. During this period, the securities that are re-lodged for transfer shall be issued only in demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests.

Relevant investors are encouraged to take advantage of this one-time window. The transfer request of physical shares can be re-lodged with our Registrar and Share Transfer Agenda (RTA) within the above-mentioned period at the following address:

MUFG Intime India Private Limited (Formerly Link Intime India Private Limited),

C-101, Embassy 247, L.B.S. Marg,

Vikhroli (West), Mumbai - 400083,

Maharashtra, India

Tel No.: +91-22-49186000

E-mail: rnt.helpdesk@in.mpms.mufg.com


Pursuant to the aforesaid circular, the Company has published newspaper advertisements [All editions of Financial Express (in English) and Ahmedabad Edition of Financial Express (in Gujarati)] on 19 July 2025 containing information about the opening of the Special Window for re-lodgment of Transfer Requests of Physical Shares. Copies of newspaper clippings are attached as **Annexure-A**, which is also available on the Company's website at www.sunpharma.com.

For **Sun Pharmaceutical Industries Limited**

(Anoop Deshpande)

Company Secretary and Compliance Officer

ICSI Membership No.: A23983



THE BOMBAY DYEING AND MANUFACTURING COMPANY LIMITED

(CIN: L17120MH1879PLC00037)

Registered Office: Neville House, J. N. Heredia Marg, Ballard Estate, Mumbai - 40001
E-mail: grievance_redressal_cell@bombaydyeing.com; Phone: (91) (22) 6662000
Website: www.bombaydyeing.com

NOTICE OF THE 145TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the One Hundred and Forty Fifth (145th) Annual General Meeting ("AGM") of the Members of The Bombay Dyeing and Manufacturing Company Limited ("the Company") will be held on Wednesday, 13th August, 2025 at 3:30 P.M. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of the 145th AGM.

The Ministry of Corporate Affairs ("MCA") has vide its Circular No. 20/2020 dated 5th May, 2020 read with Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 02/2021 dated 13th January, 2021, Circular No. 19/2021 dated 8th December, 2021, Circular No. 02/2022 dated 5th May, 2022, Circular No. 10/2022 dated 28th December, 2022, Circular No. 09/2023 dated 25th December, 2023 and Circular No. 09/2024 dated 19th September, 2024 (collectively referred to as "MCA Circulars") and the Securities and Exchange Board of India ("SEBI") vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022, Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023, Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October, 2024 (collectively referred to as "SEBI Circulars") permitted the holding of AGM through VC or OAVM, without the physical presence of the Members at a common venue. Accordingly, in compliance with the provisions of the Companies Act, 2013 ("the Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") read with the Circulars issued by MCA and SEBI, the 145th AGM of the Company will be held through VC/OAVM.

Further, electronic copies of the Annual Report for Financial Year 2024-25 of the Company which comprises of Notice for calling the 145th AGM, Directors' Report, Business Responsibility and Sustainability Report, Audited Standalone Financial Statements, Audited Consolidated Financial Statements and Auditor's Reports thereon, for the financial year ended 31st March, 2025 have been sent on Friday, 18th July, 2025 to all the Members whose e-mail addresses are registered with the Company/RTA/Depositories/Depository Participant(s) and a letter is also sent by the Company providing the web-link, including the exact path where complete details of the Annual Report (including Notice of AGM) is available, to those shareholder(s) who have not registered their e-mail addresses with the Company/RTA/Depositories/Depository Participant(s). It is also available on the Company's website at www.bombaydyeing.com, website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com, websites of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

Members may note that the Board of Directors of the Company, at its Meeting held on 5th May, 2025, have recommended a dividend of Rs. 1.20 (60%) per Equity share of face value of Rs. 2/- each for the financial year ended 31st March, 2025. The Dividend, if declared at the ensuing AGM, will be paid, subject to deduction of tax at source after 13th August, 2025, to those shareholders holding shares as on Wednesday, 6th August, 2025 (cut-off date).

Members will be able to attend the Meeting through VC/OAVM by using their remote e-voting login credentials and selecting the EVEN for the Meeting. The facility to join the Meeting shall be kept open 15 minutes before the scheduled time of commencement of the Meeting. Shareholders are requested to join the Meeting by following the procedure given in the Notice convening the 145th AGM.

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date, i.e. Wednesday, 6th August, 2025 may cast their vote electronically on the businesses as set out in the Notice of the AGM through electronic voting system of National Securities Depository Limited ("remote e-voting"). All the Members are hereby informed that:

- The businesses, as set out in the Notice of the AGM, may be transacted through remote e-voting or e-voting system at the AGM.
- The remote e-voting shall commence on Sunday, 10th August, 2025 at 9:00 a.m. (IST) and end on Tuesday, 12th August, 2025 at 5:00 p.m. (IST).
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or e-voting system at the AGM shall be Wednesday, 6th August, 2025. A person who is not a member as on the cut-off date should treat the AGM Notice for information purposes only.
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after circulation of the Notice of AGM and holding shares as of cut-off date i.e. Wednesday, 6th August, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com. However, if a person is already registered with NSDL for e-voting then the existing user ID and password can be used for casting the vote.
- Members may note that:
 - the remote e-voting module shall be disabled by NSDL after 5.00 p.m. (IST) on Tuesday, 12th August, 2025. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently.
 - the facility for voting electronically will be made available during the AGM.
 - the Members who have cast their vote by remote e-voting prior to the AGM, may also attend the AGM but shall not be entitled to cast their vote again; and
 - a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- In case of queries relating to remote e-voting/ e-voting, Members may refer to Frequently Asked Questions (FAQs) and e-voting user manual for shareholders available at the downloads section of www.evoting.nsdl.com or contact number 022 - 4886 7000 or send a request to evoting@nsdl.com. In case of any grievances/ queries relating to conduct of AGM through VC/ OAVM/ e-voting, please contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013, Email: evoting@nsdl.com or call on 022 - 4886 7000 or write to the Company at grievance_redressal_cell@bombaydyeing.com.
- The detailed procedure and instructions for remote e-voting and e-voting during the AGM are given in the Notice of the AGM.
- Mr. P. N. Parikh (FCS-327, CP-1228) and failing him, Mr. Mitesh Dhabaliwala (FCS-8331, CP-9511) and failing him, Ms. Sarvari Shah (FCS-9697, CP-11717) of M/s. Parikh & Associates, Practicing Company Secretaries, have been appointed as the Scrutinizer for conducting e-voting process and e-voting during the AGM in a fair and transparent manner.
- The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, 7th August, 2025 to Wednesday, 13th August, 2025 (both days inclusive) for the purpose of AGM.

In order to register e-mail address and/or to update bank accounts details, the Members may follow below instructions:

Physical Holding	Send a request in the prescribed form ISR-1 duly filled to the M/s. KFin Technologies Limited, Registrar and Share Transfer Agent of the Company ("KFIN") at einward.ris@kfinitech.com providing Folio No., Name of Shareholder, scanned copy of the Share Certificate (front and back) and self-attested scanned copy of PAN card and self-attested copy of any of the following document viz. Aadhar Card/Driving License/Election Identity Card/Passport for registering email address. Members may download the form ISR-1 which is available on website of the Company viz. https://bombaydyeing.com/forms.html
Demat Holding	Please contact your Depository Participant(s) (DP) and register your e-mail address as per the process advised by your DP.

The results shall be declared within two working days of conclusion of the Meeting. The declared results along with the report of the Scrutinizer will be submitted to BSE Limited and National Stock Exchange of India Limited and shall be uploaded on the website of the Company at www.bombaydyeing.com, website of NSDL at www.evoting.nsdl.com and shall be displayed on the Notice Board at the registered office of the Company at Neville House, J.N. Heredia Marg, Ballard Estate, Mumbai – 400001.

Further, for the information of the shareholders this is to inform that, in accordance with the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/ CIR/2025/97 dated 2nd July, 2025, a Special Window has been opened for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of 1st April, 2019 and rejected/ returned/ not attended to due to deficiency in the documents/ process or otherwise. The re-lodgement window shall remain open for a period of six months i.e. from 7th July, 2025 till 6th January, 2026. During this period, the securities that are re-lodged for transfer (including those requests that are pending with the Company/ RTA as on date) shall be issued only in Demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests.

For The Bombay Dyeing and Manufacturing Company Limited

Sd/-
Sanjive Arora
Company Secretary

Place: Mumbai
Date: 18th July, 2025



SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED

Regd. Office: SPARC, Tandlaja, Vadodra – 390 012, Gujarat, India.
Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon – East, Mumbai - 400 063, Maharashtra, India
Tel: 022-43244324 | CIN: L24230G1993PLC019050
Website: www.sunpharma.com Email: secretarial@sunpharma.com


NOTICE FOR SPECIAL WINDOW FOR RE-LODGE MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES

This is to inform you that the Securities and Exchange Board of India ("SEBI") vide circular: no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/ CIR/2025/97 dated 2 July 2025 has decided to open a special window only for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of 1 April 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise, for a period of six months from 7 July 2025 till 6 January 2026, in order to facilitate ease of investing for investors and to secure the rights of investors in the securities which were purchased by them. During this period, the securities that are re-lodged for transfer shall be issued only in demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests.

The concerned investors are requested to re-lodge the transfer request of physical shares, to our Registrar and Share Transfer Agenda (RTA), MUGF Intime India Private Limited (Formerly Link Intime India Private Limited), C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083, Tel No.: (022) 4918 6000, E-mail: rnt.helpdesk@in.mpmg.mvlf.com, within the above-mentioned period. Relevant investors are encouraged to take advantage of this one-time window.

Place : Mumbai
Date: 18 July 2025

For Sun Pharmaceutical Industries Limited
(Anoop Deshpande)
Company Secretary and Compliance Officer
ICSI Membership No. A23983



BATA INDIA LIMITED

CIN: L19201WB1931PLC007261
Registered Office: 27B, Carnac Street, 1st Floor, Kolkata - 700016, West Bengal
Telephone: +91 33 2289 5796 | Fax: +91 33 2289 5748
E-mail: share.dept@bata.com | Website: www.bata.in

NOTICE OF 92ND ANNUAL GENERAL MEETING AND INFORMATION ON E-VOTING AND RECORD DATE

NOTICE is hereby given that the 92nd (Ninety-second) Annual General Meeting (the "AGM" or the "Meeting") of the Members of Bata India Limited (the "Company") will be held on **Tuesday, August 12, 2025 at 11:00 A.M. (IST)** through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice convening the Meeting (the "Notice"). The Ministry of Corporate Affairs (the "MCA") vide its General Circulars No. 14/2020, No. 17/2020, No. 20/2020, No. 02/2021, No. 2/2022, No. 10/2022, No. 09/2023 and No. 09/2024 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, May 5, 2022, December 28, 2022, September 25, 2023 and September 19, 2024 respectively (hereinafter, collectively referred as the "MCA Circulars") read with SEBI Circulars No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62, No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4, No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 and No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023, October 7, 2023 and October 3, 2024 respectively (hereinafter, collectively referred as the "SEBI Circulars" and together with the MCA Circulars referred as the "Circulars"), has allowed companies to conduct their annual general meeting through VC or OAVM, in compliance with the Circulars and the relevant provisions of the Companies Act, 2013 (as amended) (the "Act") and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended) (the "Listing Regulations").

In accordance with the Listing Regulations and the Circulars, the Notice alongwith the Annual Report including Audited Financial Statements for the financial year ended March 31, 2025 have been sent only through e-mails to those Members whose e-mail addresses are registered with the Company or the Registrar and Share Transfer Agent (the "RTA") i.e., M/s. MUGF Intime India Private Limited (formerly Link Intime India Private Limited) or any of the Depositories or the Depository Participant(s) and holding equity shares of the Company as on **Friday, July 11, 2025**. The Notice and the Annual Report are available on the website of the Company viz., www.bata.in and has also been forwarded to the Stock Exchanges where Equity Shares of the Company are listed, enabling them to disseminate the same on their respective websites viz., www.nseindia.com, www.bseindia.com and www.cse-india.com. The Notice shall also be available on the e-Voting website of the agency engaged for providing e-Voting facility, i.e., National Securities Depository Limited ("NSDL"), viz., www.evoting.nsdl.com.

Members are requested to refer to the Newspaper advertisement dated July 8, 2025 issued by the Company and published on July 9, 2025 in "Financial Express" (English) and "Ekdin" (Bengali) for further details pertaining to the Meeting, Record Date and other details. The said advertisement is also available on the website of the Company and has also been forwarded to the Stock Exchanges where Equity Shares of the Company are listed, enabling them to disseminate the same on their respective websites.

Members are also informed hereby that:

- Pursuant to Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide e-Voting facilities through NSDL to its Members, in respect of the businesses to be transacted at the AGM. The manner and instructions to cast votes through remote e-Voting as well as through e-Voting system during the Meeting have been provided alongwith the Notice.
- The businesses set out in the Notice shall be transacted through e-Voting only. The Members, whose names appear in the Register of Members/List of Beneficial Owners as on **Tuesday, August 5, 2025, being the cut-off date**, shall be entitled to avail the e-Voting facility. Once vote(s) on Resolution(s) are cast by any Member, the same cannot be changed subsequently. The remote e-Voting will commence on Saturday, August 9, 2025 (9:00 A.M. IST) and will end on Monday, August 11, 2025 (5:00 P.M. IST). The module of remote e-Voting shall be disabled by NSDL at 5:00 P.M. on Monday, August 11, 2025. **A person who is not a Member as on the cut-off date, i.e. Tuesday, August 5, 2025, should treat the Notice for information purpose only.**
- Members attending the AGM, who have not cast their votes by remote e-Voting, shall be eligible to exercise their voting rights during the AGM through e-Voting system via www.evoting.nsdl.com
Members who have exercised their voting rights by remote e-Voting prior to the AGM may also attend the AGM through VC or OAVM but shall not be entitled to cast their votes again during the AGM.
- Any person, who acquires equity shares of the Company and becomes a Member after despatch of the Notice and holds shares as on the cut-off date, i.e., Tuesday, August 5, 2025 may obtain the login ID and password for e-Voting, by sending a request to NSDL at evoting@nsdl.com or to the Company at share.dept@bata.com
Members who are already registered with NSDL for remote e-Voting can use their existing User ID and Password for e-Voting.
- All documents referred to in the Notice and the Explanatory Statement thereto shall be made available for inspection by the Members of the Company, without payment of fees, upto and including the date of AGM. Members desirous of inspecting the same may send their requests at share.dept@bata.com from their registered e-mail addresses mentioning their names and folio numbers / demat account numbers.
- In case of any queries / grievances relating to e-Voting, Members may refer to "Frequently Asked Questions on e-Voting (For Shareholders).pdf" and "e-Voting Manual - Shareholder.pdf" available at the "Download" section of NSDL e-Voting website, i.e., www.evoting.nsdl.com or call on: 022 - 4886 7000 or contact Mr.Pritam Datta, Assistant Manager of NSDL or at e-mail id: evoting@nsdl.com/pritamd@nsdl.com. Members holding securities in demat mode with CDSL, can call at Toll Free No.: 1800 21 09911 or at e-mail id: helpdesk.evoting@cdslindia.com. For any further assistance, Members may also contact Mr. Nitin Bagaria, Company Secretary, Bata India Limited at Telephone No.: (0124) 3990100 / 9266686547 or at e-mail ID: share.dept@bata.com

Attention of the Members is also drawn to the SEBI Circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/ CIR/2025/97 dated July 2, 2025 on Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares, copy of which is also available on the website of the Company. The Special Window is open from July 7, 2025 and shall remain open till January 6, 2026.

For BATA INDIA LIMITED
Sd/-
NITIN BAGARIA
Company Secretary & Compliance Officer

Place : Gurugram
Date : July 18, 2025



Dhanlaxmi Bank

Dhanlaxmi Bank Limited
CIN: L65191KL1927PLC000307
Regd. Off: PB No.9, Dhanalakshmi Buildings, Naickanal, Thrissur, Kerala-680001
Ph: 0487-2999711; Fax: 0487-2335367
Corporate Office: Punnunnam, Thrissur, Kerala-680002; Ph: 0487-7107100
E-mail: investors@dhanbank.co.in; Website: www.dhanbank.com


Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares of Dhanlaxmi Bank Limited

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-POD/P/ CIR/ 2025/97 dated July 2, 2025, all shareholders are hereby informed that a Special Window is being opened for a period of six months, from July 7, 2025 to January 6, 2026 to facilitate re-lodgement of transfer requests of physical shares.

This facility is available for the Investors who had lodged their Transfer deeds prior to the deadline of April 01, 2019 and which were rejected, returned, or not attended to due to deficiencies in documents/process/ or otherwise.

The aforesaid investors are now encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Bank's Registrar and Transfer Agent i.e. KFin Technologies Limited, Selenium Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad-500032, Contact Person: G.Vasantha Rao Chowdari, Ph:1800 3094 001, Email ID: einward.ris@kfinitech.com.

For Dhanlaxmi Bank Limited
Sd/-
Venkatesh.H
Place: Thrissur
Date : July 18, 2025
Company Secretary & Secretary to the Board



METAL COATINGS (INDIA) LIMITED

CIN : L74890DL1994PLC06387
Regd. off. : 912, Hemkunt Chambers, 89, Nehru Place, New Delhi-110019
Phone : +91-11-41808125, Website : www.mcl.net, Email : info@mclindia.net

NOTICE

Transfer of Equity shares of the Company to Demat Account of the Investor Education and Protection Fund (IEPF) Authority

Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of Companies Act, 2013 ("Act") read with IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended from time to time, the Company is required to transfer the Equity shares (in respect of which the dividend declared during the financial year 2017-18 has remained unpaid or unclaimed for a period of seven consecutive years) to the demat account of the IEPF Authority.

In compliance with the Act read with the Rules, individual communication has been sent to all the shareholders at their registered address, whose Equity shares are liable to be transferred to IEPF during the Financial Year 2025-26, for taking appropriate action. A list of such shareholders who have not encashed their dividend(s) is available on the website of the Company at <https://www.mcl.net/>. **Shareholders are requested to note that in case the dividend(s) are not claimed by 20/10/2025, the unclaimed dividend for the Financial Year 2017-18 will get transferred to the IEPF. Further, the corresponding Equity shares in respect of which the dividend(s) remains unclaimed for seven consecutive years shall also be transferred in favour of IEPF Authority without any further notice to the shareholders in the following manner:**

In case the equity shares are held:

- In physical form:** the Company would issue new share certificate in lieu of original share certificate for the purpose of transfer to IEPF Authority and upon such issue, the original share certificate will stand automatically cancelled. After issue of new share certificates, the Company shall inform the Depository by way of Corporate Action to convert the share certificates into DEMAT form and transfer in the favour of the IEPF Authority.
- In dematerialized form:** the company will process the transfer of Equity shares by way of corporate action through the Depositories in favour of IEPF Authority's demat account.


Please note that upon transfer of such Equity shares to IEPF Authority, all benefits accruing on frozen shares shall also be credited to IEPF Authority and the voting rights on such shares shall remain frozen till the rightful owner claims the shares.

Members are cautioned that, pursuant to the IEPF Rules after the transfer of Equity shares to IEPF Authority no claim shall lie against the Company in respect of unclaimed dividend(s) and shares transferred to the IEPF pursuant to the said Rules. The shareholders may also note that after such transfer, shareholders/claimants can claim the transferred shares along with dividends from the IEPF Authority by making a separate application to the IEPF Authority in Form IEPF-5 as prescribed under the Rules and the same is made available at IEPF website i.e. www.iepf.gov.in.

For any information/clarifications on this matter, the concerned Shareholders/Claimants are requested to contact the Company's Registrar and Share Transfer Agents, M/s MUGF Intime India Private Limited (Formerly known as Link Intime India Private Limited), Noble Heights, 1st Floor, Plot No. NH-2, LSC, C-1 Block, Near Savitri Market, Janakpuri, New Delhi-110058; Tel No.: 011-41410593, Email: iepf.shares@in.mpmg.mvlf.com.

For Metal Coatings (India) Limited
Sd/-
Vidushi Srivastava
Company Secretary & Compliance Officer

Place: New Delhi
Dated: 18th July, 2025




ROSELABS FINANCE LIMITED

CIN : L70100MH1995PLC318333
Regd. Office: 412, Floor- 4, 17G , Vardhaman Chamber, Cawasji Patel Road, Horniman Circle, Fort, Mumbai - 400 001
Tel.: 91.22.61334400 Fax: +91.22.23024550
Website: www.roselabsfinancelimited.in E-mail: roselabsfinance@lodhagroup.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025


The Board of Directors of the Company at their meeting held on July 18, 2025 approved the unaudited financial results for the quarter ended June 30, 2025.

The unaudited financial results of the Company along with Limited Review Report, is available on the website of BSE Ltd at www.bseindia.com and also posted on the Company's website at <https://www.roselabsfinancelimited.in/investor-relation/announcement> which can be accessed by scanning the Quick Response Code.



For Roselabs Finance Limited
sd/-
Sanjyot Rangnekar
Chairperson
DIN: 07128992

Place: Mumbai
Date: July 18, 2025



JSW Steel Limited

CIN : L27102MH1994PLC152925
Registered Office: JSW Centre, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051
Tel.: 91 22 42861000 Fax: 91 22 42863000 Email: jswl.investor@jsw.in Website: www.jsw.in

Extract of Standalone Financial Results for the quarter ended 30 June 2025

(₹ in crores)

Particulars	Quarter Ended		Year Ended	
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	31,613	32,471	32,654	1,27,702
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	2,925	2,561	1,621	7,847
Net Profit / (Loss) for the period before tax(after Exceptional)	2,925	1,702	1,621	6,543
Net Profit / (Loss) for the period after tax(after Exceptional)	2,178	2,047	1,205	5,837
Total Comprehensive Income for the period[Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,129	1,237	3,090	6,208
Paid up Equity Share Capital	244	244	244	244
Paid up Debt Capital #	11,625	11,625	9,375	11,625
Reserves (excluding Revaluation Reserve) as on	81,674	79,534	78,123	79,534
Net Worth	74,228	72,050	69,155	72,050
Earnings Per Share (₹ 1 each) (not annualised):				
Basic (₹)	8.93	8.39	4.95	23.94
Diluted (₹)	8.91	8.37	4.93	23.87
Capital Redemption Reseve	774	774	774	774
Securities Premium	7,742	7,742	7,742	7,742
Debt Service Coverage Ratio	1.84	2.58	1.46	2.42
Interest Service Coverage Ratio	4.58	2.58	3.56	3.21
Debt:Equity Ratio	0.80	0.82	0.77	0.82

represents Listed Debentures


Extract of Consolidated Financial Results for the quarter ended 30 June 2025

(₹ in crores)

Particulars	Quarter Ended		Year Ended	
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	43,147	44,819	42,943	1,68,824
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	3,072	1,774	1,380	5,566
Net Profit / (Loss) for the period before tax (after Exceptional)	3,072	1,730	1,380	5,077
Net Profit / (Loss) for the period after tax (after Exceptional)	2,209	1,501	867	3,491
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,143	556	3,049	3,541
Paid up Equity Share Capital	244	244	244	244
Paid up Debt Capital #	11,625	11,625	9,375	11,625
Reserves (excluding Revaluation Reserve) as on	81,320	79,191	80,445	79,191
Net Worth	73,637	71,443	70,568	71,443
Earnings Per Share (₹ 1 each) (not annualised):				
Basic (₹)	8.95	6.15	3.47	14.36
Diluted (₹)	8.93	6.14	3.45	14.32
Capital Redemption Reseve	774	774	774	774
Securities Premium	7,720	7,720	7,720	7,720
Debt Service Coverage Ratio	1.79	2.70	1.34	1.99
Interest Service Coverage Ratio	3.78	3.22	2.87	2.90
Debt:Equity Ratio	1.15	1.17	1.06	1.17

represents Listed Debentures

Note: The above is an extract of detailed format of quarterly Financial Results filed with Stock Exchanges under regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) regulations, 2015. The Full format of quarterly Financial Results along with other items referred in regulation 52(4) of the LODR Regulations are available on the Stock Exchange Websites (www.bseindia.com & www.nseindia.com) and Company's Website (www.jsw.in) and can also be accessed by scanning the following Quick Response Code.



For JSW Steel Limited
JAYANT ACHARYA
Jt. Managing Director & CEO

Date : 18th July 2025
Place : Mumbai

epaper.financialexpress.com

Ahmedabad

Bombay Dyeing

THE BOMBAY DYEING AND MANUFACTURING COMPANY LIMITED

(CIN: L17120MH1999PLC00037)

Registered Office: Neville House, J.N. Heredia Marg, Ballard Estate, Mumbai - 400001
E-mail: grievance_redressal_cell@bombaydyeing.com; Phone: (91) (22) 66620000
Website: www.bombaydyeing.com

NOTICE OF THE 145TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the One Hundred and Forty Fifth (145th) Annual General Meeting ("AGM") of the Members of The Bombay Dyeing and Manufacturing Company Limited ("the Company") will be held on Wednesday, 13th August, 2025 at 3:30 P.M. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of the 145th AGM.

The Ministry of Corporate Affairs ("MCA") has vide its Circular No. 20/2020 dated 5th May, 2020 read with Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 02/2021 dated 13th January, 2021, Circular No. 19/2021 dated 8th December, 2021, Circular No. 02/2022 dated 5th May, 2022, Circular No. 10/2022 dated 28th December, 2022, Circular No. 09/2023 dated 25th December, 2023 and Circular No. 09/2024 dated 19th September, 2024 (collectively referred to as "MCA Circulars") and the Securities and Exchange Board of India ("SEBI") vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022, Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023, Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October, 2024 (collectively referred to as "SEBI Circulars") permitted the holding of AGM through VC or OAVM, without the physical presence of the Members at a common venue. Accordingly, in compliance with the provisions of the Companies Act, 2013 ("the Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") read with the Circulars issued by MCA and SEBI, the 145th AGM of the Company will be held through VC/OAVM.

Further, electronic copies of the Annual Report for Financial Year 2024-25 of the Company which comprises of Notice for calling the 145th AGM, Directors' Report, Business Responsibility and Sustainability Report, Audited Standalone Financial Statements, Audited Consolidated Financial Statements and Auditor's Reports thereon, for the financial year ended 31st March, 2025 have been sent on Friday, 18th July, 2025 to all the Members whose e-mail addresses are registered with the Company/RTA/Depositories/Depository Participant(s) and a letter is also sent by the Company providing the web-link, including the exact path where complete details of the Annual Report (including Notice of AGM) is available, to those shareholder(s) who have not registered their e-mail addresses with the Company/RTA/Depositories/Depository Participant(s). It is also available on the Company's website at www.bombaydyeing.com, website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com, websites of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

Members may note that the Board of Directors of the Company, at its Meeting held on 5th May, 2025, have recommended a dividend of Rs. 1.20 (60%) per Equity share of face value of Rs. 2/- each for the financial year ended 31st March, 2025. The Dividend, if declared at the ensuing AGM, will be paid, subject to deduction of tax at source after 13th August, 2025, to those shareholders holding shares as on Wednesday, 6th August, 2025 (cut-off date).

Members will be able to attend the Meeting through VC/OAVM by using their remote e-voting login credentials and selecting the EVEN for the Meeting. The facility to join the Meeting shall be kept open 15 minutes before the scheduled time of commencement of the Meeting. Shareholders are requested to join the Meeting by following the procedure given in the Notice convening the 145th AGM.

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date, i.e. Wednesday, 6th August, 2025 may cast their vote electronically on the businesses as set out in the Notice of the AGM through electronic voting system of National Securities Depository Limited ("remote e-voting"). All the Members are hereby informed that:

- The businesses, as set out in the Notice of the AGM, may be transacted through remote e-voting or e-voting system at the AGM.
- The remote e-voting shall commence on Sunday, 10th August, 2025 at 9:00 a.m. (IST) and end on Tuesday, 12th August, 2025 at 5:00 p.m. (IST).
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or e-voting system at the AGM shall be Wednesday, 6th August, 2025. A person who is not a member as on the cut-off date should treat the AGM Notice for information purposes only.
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after circulation of the Notice of AGM and holding shares as of cut-off date i.e. Wednesday, 6th August, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com. However, if a person is already registered with NSDL for e-voting then the existing user ID and password can be used for casting the vote.
- Members may note that:
 - the remote e-voting module shall be disabled by NSDL after 5.00 p.m. (IST) on Tuesday, 12th August, 2025. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently.
 - the facility for voting electronically will be made available during the AGM.
 - the Members who have cast their vote by remote e-voting prior to the AGM, may also attend the AGM but shall not be entitled to cast their vote again; and
 - a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.

vi. In case of queries relating to remote e-voting/ e-voting, Members may refer to Frequently Asked Questions (FAQs) and e-voting user manual for shareholders available at the downloads section of www.evoting.nsdl.com or contact number 022 - 4886 7000 or send a request to evoting@nsdl.com. In case of any grievances/ queries relating to conduct of AGM through VC/ OAVM/ e-voting, please contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013, Email: evoting@nsdl.com or call on 022 - 4886 7000 or write to the Company at grievance_redressal_cell@bombaydyeing.com.

vii. The detailed procedure and instructions for remote e-voting and e-voting during the AGM are given in the Notice of the AGM.

viii. Mr. P. N. Parikh (FCS-327, CP-1228) and failing him, Mr. Mitesh Dhabliwala (FCS-8331, CP-9511) and failing him, Ms. Sarvari Shah (FCS-9697, CP-11717) of M/s. Parikh & Associates, Practicing Company Secretaries, have been appointed as the Scrutinizer for conducting e-voting process and e-voting during the AGM in a fair and transparent manner.

ix. The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, 7th August, 2025 to Wednesday, 13th August, 2025 (both days inclusive) for the purpose of AGM.

In order to register e-mail address and/or to update bank accounts details, the Members may follow below instructions:

Physical Holding	Send a request in the prescribed form ISR-1 duly filled to the M/s. KFin Technologies Limited, Registrar and Share Transfer Agent of the Company ("KFIN") at elward.ris@kfinetech.com providing Folio No., Name of Shareholder, scanned copy of the Share Certificate (front and back) and self-attested scanned copy of PAN card and self-attested copy of any of the following document viz. Aadhar Card/Driving License/Election Identity Card/Passport for registering email address. Members may download the form ISR-1 which is available on website of the Company viz. https://bombaydyeing.com/forms.html
Demat Holding	Please contact your Depository Participant(s) (DP) and register your e-mail address as per the process advised by your DP.

The results shall be declared within two working days of conclusion of the Meeting. The declared results along with the report of the Scrutinizer will be submitted to BSE Limited and National Stock Exchange of India Limited and shall be uploaded on the website of the Company at www.bombaydyeing.com, website of NSDL at www.evoting.nsdl.com and shall be displayed on the Notice Board at the registered office of the Company at Neville House, J.N. Heredia Marg, Ballard Estate, Mumbai - 400001.

Further, for the information of the shareholders this is to inform that, in accordance with the SEBI Circular No. SEBI/HO/MIRSD-POD/P/2025/97 dated 2nd July, 2025, a Special Window has been opened for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of 1st April, 2019 and rejected/ returned/ not attended to due to deficiency in the documents/ process or otherwise. The re-lodgement window shall remain open for a period of six months i.e. from 7th July, 2025 till 6th January, 2026. During this period, the securities that are re-lodged for transfer (including those requests that are pending with the Company/ RTA as on date) shall be issued only in Demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests.

For The Bombay Dyeing and Manufacturing Company Limited

Sd/-
Place: Mumbai
Date: 18th July, 2025
Sanjive Arora
Company Secretary

SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED

Regd. Office: SPARC, Tandajia, Vadodara - 390 012, Gujarat, India
Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon - East, Mumbai - 400 063, Maharashtra, India
Tel: 022-43244324 | CIN: L24230GJ1993PLC019050
Website: www.sunpharma.com Email: secretarial@sunpharma.com

**NOTICE FOR SPECIAL WINDOW FOR RE-LODGE-
MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**

This is to inform you that the Securities and Exchange Board of India ("SEBI") vide circular no. SEBI/HO/MIRSD/MIRSD-POD/P/CIR/2025/97 dated 2 July 2025 has decided to open a special window only for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of 1 April 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise, for a period of six months from 7 July 2025 till 6 January 2026, in order to facilitate ease of investing for investors and to secure the rights of investors in the securities which were purchased by them. During this period, the securities that are re-lodged for transfer shall be issued only in demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests.

The concerned investors are requested to re-lodge the transfer request of physical shares, to our Registrar and Share Transfer Agenda (RTA), MUFG Intime India Private Limited (Formerly Link Intime India Private Limited), C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083, Tel No.: (022) 4918 6000, E-mail: rnt.helpdesk@in.mpmis.mufg.com, within the above-mentioned period. Relevant investors are encouraged to take advantage of this one-time window.

Place : Mumbai
Date: 18 July 2025

For Sun Pharmaceutical Industries Limited
(Anoop Deshpande)
Company Secretary and Compliance Officer
ICSI Membership No. A23983

Bata India Limited

BATA INDIA LIMITED

CIN: L19201WB1931PLC007261

Registered Office: 27B, Camac Street, 1st Floor, Kolkata - 700016, West Bengal

Telephone: +91 33 2289 5796 | Fax: +91 33 2289 5748
E-mail: share.dept@bata.com | Website: www.bata.in

NOTICE OF 92ND ANNUAL GENERAL MEETING AND INFORMATION ON E-VOTING AND RECORD DATE

NOTICE is hereby given that the 92nd (Ninety-second) Annual General Meeting (the "AGM" or the "Meeting") of the Members of Bata India Limited (the "Company") will be held on **Tuesday, August 12, 2025 at 11:00 A.M. (IST)** through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice convening the Meeting (the "Notice"). The Ministry of Corporate Affairs (the "MCA") vide its General Circulars No. 14/2020, No. 17/2020, No. 20/2020, No. 02/2021, No. 2/2022, No. 10/2022, No. 09/2023 and No. 09/2024 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, May 5, 2022, December 28, 2022, September 25, 2023 and September 19, 2024 respectively (hereinafter, collectively referred as the "MCA Circulars") read with SEBI Circulars No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62, No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4, No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 and No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023, October 7, 2023 and October 3, 2024 respectively (hereinafter, collectively referred as the "SEBI Circulars" and together with the MCA Circulars referred as the "Circulars"), has allowed companies to conduct their annual general meeting through VC or OAVM, in compliance with the Circulars and the relevant provisions of the Companies Act, 2013 (as amended) (the "Act") and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended) (the "Listing Regulations").

In accordance with the Listing Regulations and the Circulars, the Notice alongwith the Annual Report including Audited Financial Statements for the financial year ended March 31, 2025 have been sent only through e-mails to those Members whose e-mail addresses are registered with the Company or the Registrar and Share Transfer Agent (the "RTA") i.e., M/s. MUFG Intime India Private Limited (formerly Link Intime India Private Limited) or any of the Depositories or the Depository Participant(s) and holding equity shares of the Company as on **Friday, July 11, 2025**. The Notice and the Annual Report are available on the website of the Company viz., www.bata.in and has also been forwarded to the Stock Exchanges where Equity Shares of the Company are listed, enabling them to disseminate the same on their respective websites viz., www.nseindia.com, www.bseindia.com and www.cse-india.com. The Notice shall also be available on the e-Voting website of the agency engaged for providing e-Voting facility, i.e., National Securities Depository Limited ("NSDL"), viz., www.evoting.nsdl.com

Members are requested to refer to the Newspaper advertisement dated July 8, 2025 issued by the Company and published on July 9, 2025 in "Financial Express" (English) and "Ekdin" (Bengali) for further details pertaining to the Meeting, Record Date and other details. The said advertisement is also available on the website of the Company and has also been forwarded to the Stock Exchanges where Equity Shares of the Company are listed, enabling them to disseminate the same on their respective websites.

Members are also informed hereby that:

- Pursuant to Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide e-Voting facilities through NSDL to its Members, in respect of the businesses to be transacted at the AGM. The manner and instructions to cast votes through remote e-Voting as well as through e-Voting system during the Meeting have been provided alongwith the Notice.
- The businesses set out in the Notice shall be transacted through e-Voting only. The Members, whose names appear in the Register of Members/List of Beneficial Owners as on **Tuesday, August 5, 2025, being the cut-off date**, shall be entitled to avail the e-Voting facility. Once vote(s) on Resolution(s) are cast by any Member, the same cannot be changed subsequently. The remote e-Voting will commence on Saturday, August 9, 2025 (9:00 A.M. IST) and will end on Monday, August 11, 2025 (5:00 P.M. IST). The module of remote e-Voting shall be disabled by NSDL at 5:00 P.M. on Monday, August 11, 2025. **A person who is not a Member as on the cut-off date, i.e. Tuesday, August 5, 2025, should treat the Notice for information purpose only.**
- Members attending the AGM, who have not cast their votes by remote e-Voting, shall be eligible to exercise their voting rights during the AGM through e-Voting system via www.evoting.nsdl.com

Members who have exercised their voting rights by remote e-Voting prior to the AGM may also attend the AGM through VC or OAVM but shall not be entitled to cast their votes again during the AGM.

- Any person, who acquires equity shares of the Company and becomes a Member after despatch of the Notice and holds shares as on the cut-off date, i.e., Tuesday, August 5, 2025 may obtain the login ID and password for e-Voting, by sending a request to NSDL at evoting@nsdl.com or to the Company at share.dept@bata.com

Members who are already registered with NSDL for remote e-Voting can use their existing User Id and Password for e-Voting.

- All documents referred to in the Notice and the Explanatory Statement thereto shall be made available for inspection by the Members of the Company, without payment of fees, upto and including the date of AGM. Members desirous of inspecting the same may send their requests at share.dept@bata.com from their registered e-mail addresses mentioning their names and folio numbers / demat account numbers.

- In case of any queries / grievances relating to e-Voting, Members may refer to "Frequently Asked Questions on e-Voting (For Shareholders).pdf" and "e-Voting Manual - Shareholder.pdf" available at the "Download" section of NSDL e-Voting website, i.e., www.evoting.nsdl.com or call on: 022 - 4886 7000 or contact Mr.Pritam Dutta, Assistant Manager of NSDL or at e-mail id: evoting@nsdl.com or pritamd@nsdl.com. Members holding securities in demat mode with CDSL, can call at Toll Free No.: 1800 21 09911 or at e-mail id: helpdesk.evoting@cdslindia.com. For any further assistance, Members may also contact Mr. Nitin Bagaria, Company Secretary, Bata India Limited at Telephone No.: (0124) 3990100 / 9266686547 or at e-mail ID: share.dept@bata.com

Attention of the Members is also drawn to the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-POD/P/CIR/2025/97 dated July 2, 2025 on Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares, copy of which is also available on the website of the Company. The Special Window is open from July 7, 2025 and shall remain open till January 6, 2026.

For BATA INDIA LIMITED
Sd/-
Place : Gurugram
Date : July 18, 2025
NITIN BAGARIA
Company Secretary & Compliance Officer

DhanlaxmiBank

Dhanlaxmi Bank Limited
CIN: L65191KL1927PLC00307

Regd. Off: PB No.9, Dhanalakshmi Buidings, Naikanal, Thrissur, Kerala-680001
Ph: 0487-2999711; Fax: 0487-2335367
Corporate Office: Punnamm, Thrissur, Kerala-680002; Ph: 0487-7107100
E-mail: investors@ghanbank.co.in; Website: www.dhanbank.com

**Special Window for Re-lodgement of Transfer
Requests of Physical Shares of
Dhanlaxmi Bank Limited**

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-POD/P/CIR/2025/97 dated July 2, 2025, all shareholders are hereby informed that a Special Window is being opened for a period of six months, from July 7, 2025 to January 6, 2026 to facilitate re-lodgement of transfer requests of physical shares.

This facility is available for the Investors who had lodged their Transfer deeds prior to the deadline of April 01, 2019 and which were rejected, returned, or not attended to due to deficiencies in documents/process/ or otherwise.

The aforesaid investors are now encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Bank's Registrar and Transfer Agent i.e. KFin Technologies Limited, Selenium Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad-500032, Contact Person: G.Vasantha Rao Chowdari, Ph:1800 3094 001, Email ID: elward.ris@kfinetech.com.

For Dhanlaxmi Bank Limited
Sd/-
Venkatesh.H
Place: Thrissur
Date : July 18, 2025
Company Secretary & Secretary to the Board

METAL COATINGS (INDIA) LIMITED
CIN : L74899DL1994PLC063387

Regd. off. : 912, Hemkunt Chambers, 89, Nehru Place, New Delhi-110019
Phone : +91-11-41808125, Website : www.mcol.net, Email : info@mcolindia.net

NOTICE

Transfer of Equity shares of the Company to Demat Account of the Investor Education and Protection Fund (IEPF) Authority

Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of Companies Act, 2013 ("Act") read with IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended from time to time, the Company is required to transfer the Equity shares (in respect of which the dividend declared during the financial year 2017-18 has remained unpaid or unclaimed for a period of seven consecutive years) to the demat account of the IEPF Authority.

In compliance with the Act read with the Rules, individual communication has been sent to all the shareholders at their registered address, whose Equity shares are liable to be transferred to IEPF during the Financial Year 2025-26, for taking appropriate action. A list of such shareholders who have not encashed their dividend(s) is available on the website of the Company at <https://www.mcol.net/>.

Shareholders are requested to note that in case the dividend(s) are not claimed by 20/10/2025, the unclaimed dividend for the Financial Year 2017-18 will get transferred to the IEPF. Further, the corresponding Equity shares in respect of which the dividend(s) remains unclaimed for seven consecutive years shall also be transferred in favour of IEPF Authority without any further notice to the shareholders in the following manner:

In case the equity shares are held:

- In physical form:** the Company would issue new share certificate in lieu of original share certificate for the purpose of transfer to IEPF Authority and upon such issue, the original share certificate will stand automatically cancelled. After issue of new share certificates, the Company shall inform the depository by way of Corporate Action to convert the share certificates into DEMAT form and transfer in the favour of the IEPF Authority.
- In dematerialized form:** the company will process the transfer of Equity shares by way of corporate action through the Depositories in favour of IEPF Authority's demat account.

Please note that upon transfer of such Equity shares to IEPF Authority, all benefits accruing on such shares shall also be credited to IEPF Authority and the voting rights on such shares shall remain frozen till the rightful owner claims the shares.

Members are cautioned that, pursuant to the IEPF Rules after the transfer of Equity shares to IEPF Authority no claim shall lie against the Company in respect of unclaimed dividend(s) and shares transferred to the IEPF pursuant to the said Rules. The shareholders may also note that after such transfer, shareholders/claimants can claim the transferred shares along with dividends from the IEPF Authority by making a separate application to the IEPF Authority in Form IEPF-5 as prescribed under the Rules and the same is made available at IEPF website i.e. www.iepf.gov.in.

For any information/clarifications on this matter, the concerned Shareholders/Claimants are requested to contact the Company's Registrar and Share Transfer Agents, M/s MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Limited), Noble Heights, 1st Floor, Plot No. NH-2, LSC, C-1 Block, Near Savitri Market, Janakpuri, New Delhi-110056; Tel No.: 011-41410593; Email: iepf.shares@in.mpmis.mufg.com.

For Metal Coatings (India) Limited
Sd/-
Vidushi Srivastava
Place: New Delhi
Dated: 18th July, 2025
Company Secretary & Compliance Officer

ROSELABS FINANCE LIMITED

CIN : L70100MH1995PLC318333

Regd. Office: 412, Floor- 4, 17G , Vardhaman Chamber, Cawasji Patel Road, Horniman Circle, Fort, Mumbai - 400 001
Tel.: 91.22.61334400 Fax: +91.22.23024550
Website: www.roselabsfinancelimited.in E-mail: roselabsfinance@lodhagroup.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

The Board of Directors of the Company at their meeting held on July 18, 2025 approved the unaudited financial results for the quarter ended June 30, 2025.

The unaudited financial results of the Company along with Limited Review Report, is available on the website of BSE Ltd at www.bseindia.com and also posted on the Company's website at <https://www.roselabsfinancelimited.in/investor-relation/announcement> which can be accessed by scanning the Quick Response Code.



For Roselabs Finance Limited

Sd/-
Sanjyot Rangnekar
Chairperson
DIN: 07128992

JSW Steel Limited

CIN : L27102MH1994PLC152925

Registered Office: JSW Centre, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051
Tel.: 91 22 42861000 Fax: 91 22 42863000 Email: jswsl.investor@jsw.in Website: www.jsw.in

Extract of Standalone Financial Results for the quarter ended 30 June 2025

Particulars	Quarter Ended				Year Ended
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025	
	Unaudited	Audited	Unaudited	Audited	
Total income from operations	31,613	32,471	32,654	1,27,702	
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	2,925	2,561	1,621	7,847	
Net Profit / (Loss) for the period before tax(after Exceptional)	2,925	1,702	1,621	6,543	
Net Profit / (Loss) for the period after tax(after Exceptional)	2,178	2,047	1,205	5,837	
Total Comprehensive Income for the period[Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,129	1,237	3,090	6,208	
Paid up Equity Share Capital	244	244	244	244	
Paid up Debt Capital #	11,625	11,625	9,375	11,625	
Reserves (excluding Revaluation Reserve) as on	81,674	79,534	78,123	79,534	
Net Worth	74,228	72,050	69,155	72,050	
Earnings Per Share (₹ 1 each) (not annualised):					
Basic (₹)	8.93	8.39	4.95	23.94	
Diluted (₹)	8.91	8.37	4.93	23.87	
Capital Redemption Reseve	774	774	774	774	
Securities Premium	7,742	7,742	7,742	7,742	
Debt Service Coverage Ratio	1.84	2.58	1.46	2.42	
Interest Service Coverage Ratio	4.58	2.58	3.56	3.21	
Debt-Equity Ratio	0.80	0.82	0.77	0.82	

represents Listed Debentures

Extract of Consolidated Financial Results for the quarter ended 30 June 2025

	(₹ in crores)			
Particulars	Quarter Ended			Year Ended
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	43,147	44,819	42,943	1,68,824
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	3,072	1,774	1,380	5,566
Net Profit / (Loss) for the period before tax (after Exceptional)	3,072	1,730	1,380	5,077
Net Profit / (Loss) for the period after tax (after Exceptional)	2,209	1,501	867	3,491
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,143	556	3,049	3,541
Paid up Equity Share Capital	244	244	244	244
Paid up Debt Capital #	11,625	11,625	9,375	11,625
Reserves (excluding Revaluation Reserve) as on	81,320	79,191	80,445	79,191
Net Worth	73,637	71,443	70,568	71,443
Earnings Per Share (₹ 1 each) (not annualised):				
Basic (₹)	8.95	6.15	3.47	14.36
Diluted (₹)	8.93	6.14	3.45	14.32
Capital Redemption Reseve	774	774	774	774
Securities Premium	7,720	7,720	7,720	7,720
Debt Service Coverage Ratio	1.79	2.70	1.34	1.99
Interest Service Coverage Ratio	3.78	3.22	2.87	2.90
Debt-Equity Ratio	1.15	1.17	1.06	1.17

આવાસ ફાઇનાન્સિયલ્સ લીમીટેડ

(CIN : L65922RJ2011PLC034297) રજુ. અને કોર્પો. ઓફીસ : ૨૦૧-૨૦૨, બીએ માળ, સાઈથ એન્ડ ૨૬૬૨, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જયપુર-૩૦૨૦૨૦



કંપન નોટીસ			
જત ખતાવાતાનું છે નીચે સહી કરનાર આવાસ ફાઇનાન્સિયલ્સ લીમીટેડ ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇઝેશન અને ફિકન્ડન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એક્ટેર અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ,૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી કલમ ૧૩(૧) હેઠળ મને મળેલ સત્તાનો ઉપયોગ કરીને જણાવેલ નોટીસની બજાવણીની તારીખથી ૬૦ દિવસની રકમ સંબંધિત નોટીસમાં નીચે જણાવેલ રકમ ચુકવવી જમા દેવાદારોને માંગણી નોટીસ પાઠવી હતી. દેવાદારે રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ પડતા જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ ફાયાદની કલમ ૧૩(૧) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલે મિલકતોની કબજા નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અને જમીનદારોએ અને જાહેર જનતાને અહીં સાવધ કરવામાં આવે છે કે મિલકત સાથે કોઇ વ્યવહાર કરવો નહીં અને મિલકત સાથેની કોઇ પણ વ્યવહાર આવાસ ફાઇનાન્સિયલ્સ લીમીટેડ ના સહી નીચે જણાવેલ રકમ અને તેના પરના ચકત વ્યાજને આધિન રહેશે.			
દેવાદારનું નામ	માંગણા નોટીસની તારીખ અને રકમ	મિલકતની વિગત	કબજા નોટીસની તારીખ અને કક્કાર
વિષ્ણુ દેવી, પ્રેમ સુખ, મગરાજ ગુપ્તામાર, જમીનદાર : સુનિલ કુમાર મનોજ કુમાર હોલેલોત (A/C NO.) LNSUR00319-200119318	૧૧-૦૪-૨૦૨૫ રૂ. ૨૪૮૫૫૩૮/- ૧૧-૦૪-૨૦૨૫ મુજબ	મુકામ-ફટેર નં. ૬૦૨, પાસપાઈટ કોમ્પ્લેક્સ, છછો માળ, સિટી સર્વે નં. ૫૦૮, ૫૦૯ અને ૫૧૦, વોર્ડ નં. ૬, ગાલેમંડી મેઇન રોડ, ખરડાં શેરી-કોલસાવાડ, સુરત, ગુજરાત ખાતેની મિલકત. ફોનફોન ૬૬.૬૮૪૮ ચો.મી.	૧૬-૦૬-૨૦૨૫ નાં સેષ સંકેતિક કબજે પેદાશો
મનરુપમાળી બીળામાળ પરમાર, જયાબેળ પરમાર (A/C NO.) LNSNA00615-160022325 & LNSNA04318-190073094	૧૪-૧૨-૨૦૨૧ રૂ. ૧૫૭૯૮૩૦.૪૧/- રૂ. ૫૨૮૧૪૫.૪૧/- ૧૩-૧૨-૨૦૨૧ મુજબ	પ્લોટ નં. ૩૧૯, રેવન્યુ સર્વે નં. ૧૭૫૫/૫૬(૧) અને ૧૭૫૫/૫૬(૨), સહજાનંદ દાંડિબાઈ, સામિલિયા ટાઉનશિપ સામે, મહર્ષી ગુરુકુળ સાનેશવા પાસે, મુકામ-હવાલ, જિતો-મોરબી, સંજોલટ, ગુજરાત. ફોનફોન ૧૪૪.૪૫ ચો.મી.	૧૦-૦૬-૨૦૨૫ નાં સેષ સંકેતિક કબજે પેદાશો
સ્થળ : જયપુર, તારીખ : ૧૬-૦૬-૨૦૨૫	અધિકૃત અધિકારી આવાસ ફાઇનાન્સિયલ્સ લીમીટેડ		

જના સ્મોલ ફાયનાન્સ બેંક (રજીસ્ટર્ડ ઓફીસ: ઢાંચે રહે, ઝાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં ૧/૧, ૧/૨ અને ૧/૨/બી, ઓફ ઓમલુર, કોમર્સીયલ ઇન્ડસ્ટ્રી રોડ, ઘણુએલ નિયમોના પાર્ક પાછી, રાધામઢા, બેંગલોર-૫૯૦૦૧૭. રીજનલ ટાઇપ ઓફીસ : ઝાઉન્ડ ફ્લોર, બીએ માળ, સાંગરીલા આર્કડ, સારસ્વત બેંક ઉપર, ૧૦૦ ફૂટ અંતરનગર રોડ, રાધામઢા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫)

સરફેસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ
આથી તમો નીચે જણાવેલ દેવાદારો, સહ-દેવાદારો, જમીનદારો અને ગીરવેદારોએ **જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ** પાસેથી તમારી સ્થાવર મિલકતોના ગીરો દ્વારા લોન મેળવી છે. તમો તમામ દ્વારા કરાયેલ કસુના પહિલાએ તમારા લોન ઓકાઉન્ટ નોન-પરફોર્મિંગ એક્ટેર તરીકે વર્ગીકૃત થયા છે, આથી **જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ** સિક્યોર્ડ લેવદારની રૂએ એક્ટ હેઠળ અને સિક્યોર્ટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૨ સાથે જણાવેલ એક્ટરની કલમ ૧૩(૨) ના વાંચન હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને માંગણા નોટીસ પાઠવી કરી કોલમ નં. ૨ ના પચાવેલ દેવાદારો/સહ-દેવાદારો/ જમીનદારો/ગીરવેદારોને નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર નોટીસોમાં જણાવેલ રકમ તેના પરના ચકત વ્યાજ પહેલિ ચુકવી જમા માટે જણાવ્યું હતું, પરંતુ વિવિધ કક્કારોસર તેમાંથી કેટલાકને નોટીસની બજાવણી થઇ શકી ન હતી.

	દેવાદાર / સહ-દેવાદાર/ જમીનદાર / ગીરવેદારનું નામ	લોન ઓકાઉન્ટ નંબર અને નોટીસ રકમ	ઢાંચમાં લેવાનાર સિક્કોસીટીની વિગતો	ઓનીએનો તારીખ અને માંગણા નોટીસની તારીખ	બાકી રકમ રૂ. માં /ના સેષ
૧	૧) મોનાલીબેળ બ્રહ્મભટ્ટ, ૨) મનુભાઈ બ્રહ્મભટ્ટ	લોન ઓકાઉન્ટ નંબર 31809630001100 લોનની રકમ રૂ. ૫,૧૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : જિતો આણંદ, પેટા જિતો આણંદ, મોયે બાકરોલ, એલિટોન કમ્પાસી કો.ઓપ. હાઉસીંગ રોડ બી. ૨૨૯૦૧૨૨૮+૨૨૨૯, ફોરેક્રડ ૭૮૮૧ ચો.મી., હાઉસ નં. ૧૭૪, ફોરેક્રડ ૪૮.૦૦ ચો.મી., જુનો નગર પાલિકા મિલકત નં. ૪૫૬૬. બ્લુ નં. ૧ વી ચતુ:સીમા : પુર્વ: માર્જિન પછી રોડ, પશ્ચિમ: રોડ, ઉત્તર: હાઉસ નં. ૧૦ ૩ની મિલકત, દક્ષિણ: ૧૦૫ની મિલકત	ઓનીએનો તારીખ : ૦૨/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૭/૨૦૨૫	રૂ. ૫,૦૭,૮૯૨/- (રૂપિયા પાંચ લાખ સાત હજાર આઠસો બ્ચારી પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 30559420000023 લોનની રકમ રૂ. ૧૬,૬૩,૩૭૧/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : કન્વર્ટફેક્ટેરેસીડેન્સીયલ મિલકત ફોરેક્રડ ૫૪.૬૪ ચો.મી., માધાપુર રેવન્યુ સર્વે નં. ૧૦ પૈકી પ્લોટ નં. ૧ થી ૪, ૯ થી ૧૩, ૧૫ થી ૨૩ પૈકી સિદ્ધિ ૫ પૈકી પ્લોટનં. ૧૧ પૈકી, વિંગ-એન પી, ફ્લેટ નં. ૧૦૧, પહેલો માળ, સંજોલટ ખાતેની મિલકત. ચતુ:સીમા : પુર્વ: માર્જિન પછી અન્ય મિલકત, પશ્ચિમ: સીડીઓ, કોમન પેસેજ, ફ્લેટ નં. ૧૦૧, ઉત્તર: લિંગ-એમ, દક્ષિણ: ફ્લેટ નં. ૧૦૨.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૦/૦૭/૨૦૨૫	રૂ. ૧૬,૫૫,૫૫૪/- (રૂપિયા સોળ લાખ સોપન હજાર પાંચસો સોપન પુરા)
૩	૧) ગામિત વિનચર્માઈ બાંબલાઈ ૨) ગામિત સુવર્ણબેળ બાંબલાઈ	લોન ઓકાઉન્ટ નંબર 45249420000592 લોનની રકમ રૂ. ૧૯,૧૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : મંબુર ફરેલ પ્લાન મુજબ પ્લોટ નં. એ-૩૫, ફોરેક્રડ ૧૫.૭૯ ચો.મી. અને ૫૮.૯૦ ચો.મી. ઝાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર બંધાયેલ તેમજ રોડ અને સીઓપીની બીઆન નં વહેચાયેલ હિસ્સોસાગવતી ઓમ રેસીડેન્સીમાં, બ્લોક નં. ૩૭૨ ફોરેક્રડ ૧૨૧૦૦ ચો.મી., મોયે ગામ કાનુગરા, તાલુકો વ્ચાટ, જિતો વાપી ખાતેની વિનચર્માઈ બ્લુમાઈ ગામિતની માલિકીની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: પાલોટ નં. એ-૨૪, પશ્ચિમ: સોસાચટીનો અંદરનો રોડ, ઉત્તર: પ્લોટ નં. બી-૧૪, દક્ષિણ: સોસાચટીનો અંદરનો રોડ	ઓનીએનો તારીખ : ૦૨/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૭/૨૦૨૫	રૂ. ૧૬,૪૫,૫૫૪/- (રૂપિયા સોળ લાખ સોપન હજાર પાંચસો સોપન પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 31799420000072 લોનની રકમ રૂ. ૨૭,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : બ્લોક/સર્વે નં. ૭૬૫ પૈકી, પ્લોટ નં. ૮૫ ફોરેક્રડ ૧૦૨.૮૨ ચો.મી.ની નિબ ખેતીલાયક જમીન પર બંધાયેલ માગ કંકોલ, તાલુકો હિંમતનગર, જિતો સાબરકાંઠા ખાતેની એનએ. સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: રોડ, પશ્ચિમ- માર્જિન પછી પ્લોટ નં. ૬૮, ઉત્તર: પ્લોટ નં. ૮૪, દક્ષિણ: માર્જિન પછી પ્લોટ નં. ૮૬.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૨૬,૫૦,૭૩૮/- (રૂપિયા છવ્વીસ લાખ છવ્વીસ હજાર આઠસો ચોવીસ પુરા)
૫	૧) સમીરજીલી જીતેશજીલી ૨) રસેશ રિમરનખાનુ સમીરજીલી	લોન ઓકાઉન્ટ નંબર 483694200000114 લોનની રકમ રૂ. ૮,૯૭,૬૪૬/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : બ્લોક/સર્વે નં. ૧૨૫/૧ પૈકી, પ્લોટ નં. ૪૦૯ (પુર્વ બાજુ), ફોરેક્રડ આશરે ૪૬.૪૫ ચો.મી., ગામ સંગઢ, તાલુકો હિંમતનગર, જિતો સાબરકાંઠા ખાતેની મિલકત પર બંધાયેલ એન.એ સ્થાવર રેસીડેન્સીયલ મિલકત. ચતુ:સીમા : પુર્વ: પ્લાન મુજબ પ્લોટ નં. ૪૦૯ પૈકી, પશ્ચિમ: પ્લાન મુજબ પ્લોટ નં. ૪૦૯ પૈકી, ઉત્તર: પ્લાન મુજબ પ્લોટ નં. ૪૦૯ પૈકી, દક્ષિણ: પ્લાન મુજબ ૭.૫૦ મીટર રોડ	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૮,૦૦,૦૫૨/- (રૂપિયા પાંચ લાખ રૂપિયા હજાર બારસો પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 315294200003580 લોનની રકમ રૂ. ૬,૪૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : સપ પ્લોટ નં. ૪૪-૪૫-૪૬/૫૬(૧)/, જમીન ફોરેક્રડ ૧૫-૩૮ ચો.મી., પ્લોટ નં. ૪૪ થી ૪૬, રેવન્યુ સર્વે નં. ૨૫/૫૬(૨) પૈકી જમીન ફોરેક્રડ એક્ટ ૨૦ ૧૯તુકરા પાડા, વેલિડા પાર્ક-૧ તરીકે જાણીતી, બેપુર નવાઢ નગરપાલિકાની હદમાં, ઓડોન્ટેલ બેપુર, જિતો સંજોલટ ખાતેની ખુબી એન.એ.જમીનનો પાલિકાની માલિકીની મિલકત. ચતુ:સીમા : પુર્વ: સપ પ્લોટ નં. ૪૪-૪૫-૪૬/૫૬(૧)/કીની મિલકત, પશ્ચિમ: સપ પ્લોટ નં. ૪૪-૪૫/૪૬/૫૬(૧)/કીની મિલકત, ઉત્તર: સપ પ્લોટ નં. ૪૪-૪૫-૪૬/૫૬(૧)/કીની મિલકત, દક્ષિણ: ૬-૧૦+૫-૫૦ =૧૨-૫૦ મીટર પહોળો રોડ	ઓનીએનો તારીખ : ૦૨/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૬,૮૬,૭૨૮/- (રૂપિયા પાંચ લાખ સાત હજાર સાતસો અઢવાલીસ પુરા)
૭	૧) સતેશ સુરજ મેરુભાઈ ૨) સતેશ સંગિતાબેળ સુરજભાઈ ૩) સતેશ મેરુભાઈ વિપરાજભાઈ ૪) સતેશ રૂપાબેળ મેરુભાઈ	લોન ઓકાઉન્ટ નંબર 3148961400000160 લોનની રકમ રૂ. ૮,૧૫,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૮,૦૦,૦૫૨/- (રૂપિયા પાંચ લાખ પચાસ હજાર બ્ચારો હદવાલીસ પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 3179944000000083 લોનની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૪,૭૪,૮૧૬/- (રૂપિયા ચાર લાખ દસ હજાર છસો વચ્ચારી પુરા)
૯	૧) પરમાર મહેન્સિંહ, ૨) પરમાર સમયકુબેળ	લોન ઓકાઉન્ટ નંબર 3179944000000083 લોનની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૪,૭૪,૮૧૬/- (રૂપિયા ચાર લાખ ચુમ્ભોતે હજાર આઠસો સોળ પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 317994300000271 લોનની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: પરમાર ગુલેન્ડસિંહ હાઠીસિંહનું ઘર, પુર્વ : આર.સી.સી. રોડ, પશ્ચિમ : આર.સી.સી. રોડ	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૪,૯૭,૮૧૬/- (રૂપિયા ચાર લાખ ચુમ્ભોતે હજાર આઠસો સોળ પુરા)
૧૦	૧) મેમણ હિદયતમહમ્દ ઉમાશાવભાઈ, ૨) મેમણ હસિનાબેળ	લોન ઓકાઉન્ટ નંબર 31799420001118 લોનની રકમ રૂ. ૧૮,૧૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૧૮,૧૦,૦૦૦/- (રૂપિયા અઢાર લાખ સુલતાલીસ હજાર છસો અઢાર પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 518104300000863 લોનની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૪,૭૪,૮૧૬/- (રૂપિયા ચાર લાખ સત્તાવું હજાર આઠસો અઢાર પુરા)
૧૧	૧) હાલિયા શુક્રાભાઈ શમયુભાઈ, ૨) હાલિયા સુમિયાબેળ શુક્રાભાઈ	લોન ઓકાઉન્ટ નંબર 518104300000863 લોનની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ગામલત મિલકત નં. ૬૪ ફોરેક્રડ આશરે ૧૦૦૦.૦૦ ચો.ફૂટ, ૬૫નીલા, બ્ચારડિયા ગુપ આમ પંચાચતીલ, તાલુકો મોહસા, જિતો અરવાલી ખાતેની હદમાં, અને સ્થાવર રેસીડેન્સીયલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ખુબી પ્લોટ, પશ્ચિમ: ખુબી પ્લોટ, ઉત્તર: રોડ, દક્ષિણ: ખુબી જમીન.	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૪,૭૪,૮૧૬/- (રૂપિયા ચાર લાખ સત્તાવું હજાર આઠસો અઢાર પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 315294200002880 લોનની રકમ રૂ. ૧૧,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ફ્લેટ નં. ૪૦૪, કાપેટ એરિયા ફોરેક્રડ ૪૮-૪૭૦ ચો.મી., ચોચો માળ, ‘શ્રી સ્થામ કો. ઓ.હાઉસિંગ સોસાયટી લીમીટેડ’ તરીકે જાણીતી ઓપાટેન્ડ, જુનાઢ ફાઉન્ડેશન જમીનો પ્લોટ નં. ૬ બીઆઈસી ૪૮૬-૨૦ ચો.મી., રેવન્યુ સર્વે નં. ૧૨૩/૨ જમીન ફોરેક્રડ એક્ટ ૨-૨૬ જુનાઢ, જુનાઢ, મોઢારડો રોડ તરીકે જાણીતી એરિયા, જુનાઢમ મ્યુનિસિપલ કોર્પોરેશની સીમા ખાતેની સ્થાવર મિલકત. ચતુ:સીમા : પુર્વ: ફ્લેટ નં. ૪૦૩, પશ્ચિમ: લોકેટી મિલકત, ઉત્તર: સીડીનો પેસેજ અને ક્રોમન પેસેજ અને ફ્લેટની મુખ્ય દરવાજા, દક્ષિણ: પડખેનો રોડ	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૩/૦૭/૨૦૨૫	રૂ. ૧૨,૨૭,૯૫૨/- (રૂપિયા બાર લાખ ત્રીસ હજાર ત્રણસો બાવન પુરા)
૧૩	૧) કટારા જયંતિભાઈ, ૨) કટારા તારાબેળ	લોન ઓકાઉન્ટ નંબર 330294200000123 લોનની રકમ રૂ. ૧૫,૧૮,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : મોયે-કડોટર, પલ્લવાણ, જમીનનો રેવન્યુ સર્વે નં. ૧૦૨૧ અને ૧૦૨૨, બ્લોક નં. ૧૦૪ અને ૧૦૫/૧૦૬, ‘સિદ્ધિ રેસિડેન્સીયલ’, પૈકી પ્લોટ નં. ૧૧૭, ૧૧૮ અને ૧૧૯, ‘અપેક્ષરેસી’ તરીકે જાણીતી, લો સર્કિલ મિલકત નં. પૈકી, બીએમબા, ફ્લેટ નં. ૨૦૬, વિલ્ટ એર એરિયા ફોરેક્રડ ૨૦.૮૫ ચો.મી., આશરે ૩૩૩.૫૫ ચો. ફૂટ, મુકામ-રુદ્રજેન જિતો-પલ્લવાણ, રુદ્રજેન-ગુરૂત ખાતેની સ્થાવર વિન-ખેતીલાયક પ્લોટ અને જમીનનો તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : ઉત્તર : સીડી પ્લોટ નં. ૧૨૦, પુર્વ : સોસાચટીનો રોડ, દક્ષિણ : સી.ઓ.પી. મુખ્ય : પ્લોટ નં. ૧૧૦, ૧૧૧, ૧૧૨	ઓનીએનો તારીખ : ૦૨/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૭/૨૦૨૫	રૂ. ૧૪,૫૫,૫૬૮/- (રૂપિયા ચૌદ લાખ પંદર હજાર પાંચસો ચરકા)
		લોન ઓકાઉન્ટ નંબર 452494200002502 લોનની રકમ રૂ. ૮,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : ફ્લેટ નં. ૭૦૫, સાતમો માળ, બ્લોક એલ, ફોરેક્રડ ૭૫ ચો. ફૂટ, રુદ્રજન વિલ્ટ એર એરિયા ૩૪.૪૮ ચો.મી., કાપેટ એરિયા તેમજ જમીનનું ફોરેક્રડ ૧૨ ચો.મી., ‘દેવનંદન સેસિલ સિટી’ તરીકે જાણીતી રેડીંગ, બાબાજીના પ્લોટ નં. ૬૧, રેવન્યુ સર્વે નં. ૭૫ પૈકી ૧, ટીવી રેડીંગ નં. ૧૧૨, ફાગનવલ અને ૧૧૪ પૈકી અને મુકામ-મોયે-હંસુરા, તાલુકો-કોટડા, રુદ્રજેન જિતો-અરઘવાલ અને પેટા વિત્તો-અરઘવાલ-૬ (નંદરા) ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ : ફ્લેટ નં. એલ-૭૦૬, પશ્ચિમ : ફ્લેટ નં. એલ-૭૦૭, ઉત્તર : સોસાચટીનો રોડ, દક્ષિણ : ફ્લેટ નં. એલ-૭૦૨	ઓનીએનો તારીખ : ૧૧/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૭/૨૦૨૫	રૂ. ૮,૦૭,૩૨૬/- (રૂપિયા આઠ લાખ સાત હજાર ત્રણસો છવીસ પુરા)
૧૪	૧) સંજયનું પુરુષિક ખેરનારા, ૨) ખેરનારા કિમલ રાજુ	લોન ઓકાઉન્ટ નંબર 452494200002502 લોનની રકમ રૂ. ૮,૦૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : મોયે-કડોટર, પલ્લવાણ, જમીનનો રેવન્યુ સર્વે નં. ૧૦૨૧ અને ૧૦૨૨, બ્લોક નં. ૧૦૪ અને ૧૦૫/૧૦૬, ‘સિદ્ધિ રેસિડેન્સીયલ’, પૈકી પ્લોટ નં. ૧૧૭, ૧૧૮ અને ૧૧૯, ‘અપેક્ષરેસી’ તરીકે જાણીતી, લો સર્કિલ મિલકત નં. પૈકી, બીએમબા, ફ્લેટ નં. ૨૦૬, વિલ્ટ એર એરિયા ફોરેક્રડ ૨૦.૮૫ ચો.મી., આશરે ૩૩૩.૫૫ ચો. ફૂટ, મુકામ-રુદ્રજેન જિતો-પલ્લવાણ, રુદ્રજેન-ગુરૂત ખાતેની સ્થાવર વિન-ખેતીલાયક પ્લોટ અને જમીનનો તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : ઉત્તર : સીડી પ્લોટ નં. ૧૨૦, પુર્વ : સોસાચટીનો રોડ, દક્ષિણ : સી.ઓ.પી. મુખ્ય : પ્લોટ નં. ૧૧૦, ૧૧૧, ૧૧૨	ઓનીએનો તારીખ : ૦૨/૦૭/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૭/૨૦૨૫	રૂ. ૮,૦૭,૩૨૬/- (રૂપિયા આઠ લાખ સાત હજાર ત્રણસો છવીસ પુરા)
		લોન ઓકાઉન્ટ નંબર 451894300000211 લોનની રકમ રૂ. ૨૧,૩૫,૦૮૨/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : મુકામ-મોયે-કડોટર, પલ્લવાણ, રુદ્રજેન જિતો-અરઘવાલ અને પેટા વિત્તો-અરઘવાલ-૬ (નંદરા) ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ : માર્જુન રોડ, પશ્ચિમ : સિટી રોડ નં. ૬૭૯૬/૧/૫/૭૨ મુજબ પ્લોટ નં. ૬૭૯૬/૧/૫/૭૨ ના મુજબ પ્લોટની મિલકત	ઓનીએનો તારીખ : ૦૮/૦૮/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૦/૦૮/૨૦૨૫	રૂ. ૨૧,૧૪,૧૦૭/- (રૂપિયા એકવીસ લાખ ચુમ્ભોતે હજાર એકસો સાત પુરા)
૧૬	૧) મીનાબેળ બોધ ૨) વિશ્વમુખાબાઈ બોધ	લોન ઓકાઉન્ટ નંબર 451882400000105 લોનની રકમ રૂ. ૪,૧૦,૦૦૦/-	ગીરો સ્થાવર મિલકત – મિલકતની વિગત : મોયે-ચંકલાવ, વડેશ્વર, જમીન ‘ઈન્ડિયા સેલોની ગામ પંચાયત નં. ૩૨૫૧, પ્લોટ ફોરેક્રડ ૪૮૦ ચો. ફૂટ, બાંધકામ ફોરેક્રડ ૫૦૦ ચો.મી. ફૂટ, મુકામ-રુદ્રજેન જિતો અને પેટા વિત્તો-ચંકલાવ, વિત્તો-આણંદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ : રમેશભાઈ ઓઘેરનું ઘર, પશ્ચિમ : રોડ, ઉત્તર : રોડ, દક્ષિણ : અજીસાબાઈનું ઘર	ઓનીએનો તારીખ : ૧૧/૦૮/૨૦૨૫ માંગણા નોટીસની તારીખ : ૧૧/૦૮/૨૦૨૫	રૂ. ૪,૪૨,૬૮૬/- (રૂપિયા ચાર લાખ બેઠારીસ હજાર છસો છવાલીસ પુરા)